

ટ્રાન્સ વર્લ્ડ રેડિયો - ઈન્ડિયા

“વિજેતા” પ્રાર્થના કેલેન્ડર - જુલાઈ, ૨૦૨૩

પો.બો. નં. ૨૦૩૬, ફતેહગંજ, વડોદરા - ૩૯૦૦૦૨

- (૧) સહનશીલ વિશ્વાસ : વ્હાલા પ્રભુ, મારી વિચારસરણીને દૈવિય ચાલવામાંથી વિશ્વાસથી ચાલવા તરફ વાળો. જો ખ્રિસ્ત મારામાં રહે છે તો મારી પાસે ઈશ્વરને જોવા આત્મિક આંખો હોવી જોઈએ. તેથી દરેક બાબતોમાં તમને કાર્યરત જોવા માટે સહાય કરો. ત્યારબાદ તમારા પર વિશ્વાસ રાખીને મુશ્કેલીઓ સહન કરવા મને સહાય કરો. (હિબ્રુ ૧૧:૨૭)
- (૨) તેમની સેવામાં : વ્હાલા પ્રભુ હું માનતો હતો કે હું તમારી સેવા કરું છું, પરંતુ હવે હું જોઉં છું કે મારા દૈહિક પ્રયત્નો માત્ર મૃત કાર્યો જ ઉત્પન્ન કરી રહ્યા હતા. હે ઈશ્વર, તમે મારા છો અને હું તમારો એ મને બતાવવા બદલ તમારો આભાર. તમે મારા દ્વારા તમારાં સારાં કાર્યો પૂર્ણ કરી શકો તે માટે રાજીખુશીથી મારી જાતને તમારા માટે ઉપલબ્ધ કરું છું. (પ્રે.કૃત્યો ૨૭:૨૩)
- (૩) ઈશ્વરની હાજરી : વ્હાલા પ્રભુ ઈસુ મેં એકવાર એવું વિચાર્યું કે જ્યારે ખરાબ બાબતો બને ત્યારે જ મારે તમારી જરૂર છે, પરંતુ જ્યારે તમે મારામાં વસો છો ત્યારે ખ્યાલ આવ્યો કે મારે તમારા પર દરેક બાબતોમાં આધાર રાખવો જોઈએ. મારી સાથે અતૂટ બંધનમાં જોડાવા બદલ તમારો આભાર કે જેથી તમારી હાજરી મારામાં કાયમ રહે. (નિર્ગમન ૩૩:૧૫)
- (૪) ઈશ્વરનું રક્ષણ : હે પ્રભુ, ક્યારેક એવું લાગે છે કે દરેક મારી વિરુદ્ધ છે, પરંતુ તમે મારી પાસે છો તેથી કોઈ મને કચડી શકતું નથી. તમારી હાજરીનું પ્રબળ સામર્થ્ય મારી આંતરિક સુરક્ષા છે. મારી આસપાસ મારા શત્રુઓ કરતાં તમારી હાજરી પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા સહાય કરો. (ગી.શા. ૯:૩)
- (૫) જીવન જીવવા માટે છે : હે પ્રભુ ઈસુ, જ્યારે મેં તમને મારા પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર્યા ત્યારે તમે મારામાં વસવા આવ્યા માટે હું તમારો આભારી છું. જીવનના સ્વામી, તમે મારું જીવન બનવા આવ્યા છો. તેથી હું મારા દ્વારા તમારું જીવન જીવવા માટે મારું જીવન તમને સોંપું છું. હું પ્રાર્થના કરું છું કે તમે મારી સાથે માર્ગમાં રહો અને મારા દ્વારા તમે ઓળખાવ. (ગલાતી ૨:૨૦)
- (૬) ચિંતા : “હું તમને કહું છું કે તમારા જીવનની ચિંતા કરશો નહિ ...” (માથ્થી ૬:૨૫) ઈસુના શિષ્યને ચિંતા કરવાની જરૂર નથી. તેનું જીવન વિશ્વને ચલાવનારના હાથમાં સુરક્ષિત છે અને તેની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. ચિંતાઓને ના કહો. તેઓ તેમના આત્માની દોરવણીને પારખવા અને તેમની દિશામાં ચાલવા માટે ઈશ્વરને તેમના ડહાપણ માટે જણાવે એવું થવા દો.
- (૭) પરીક્ષણ : “માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે. તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ.” (૧ કરિંથી ૧૦:૧૩) આપણે પતિત જગતમાં રહીએ છીએ અને પરીક્ષણ માટે સંવેદનશીલ છીએ, પરંતુ તમે જીવનના તોફાનોમાં હંમેશા પ્રભુ પર ભરોસો રાખી શકો છો. તે તમારી પ્રાર્થનાઓ સાંભળે છે.
- (૮) ઈશ્વર વિશ્વાસુ છે : “પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. જ્યારે અંધકારનો રાજકુમાર તમારા વિશ્વાસને બુઝાવવા માંગે છે અને અવિશ્વાસ અને બીકના જવલંત કાકડાઓ તમારા પર ફેંકે છે ત્યારે તમે ઈશ્વરને અને તેમના વચનને વળગી રહો. તે તમને આશીર્વાદ આપવા માંગે છે અને તમને છૂટકાનો માર્ગ પણ બતાવશે.”
- (૯) નારાજગી : “પ્રીતિ અપકારને લેખવતી નથી.” (૧ કરિંથી ૧૩:૫) નારાજગી સંબંધોમાં કડવાશ અને ઝેર તરફ દોરી જાય છે. હે પુરુષ, ઈશ્વરને તેમનો પ્રેમ વહેવડાવવા દો અને માફી તમને તેના કેદી બનાવે અને તમારા તારણનો આનંદ ગુમાવો તે પહેલાં માફ કરવાનું તેમની પાસેથી શીખો.

- (૧૦) વિલંબ : “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે.” (એફેસી ૫:૧૫, ૧૬) તત્કાલીનથી દૂર ન થાઓ નહીં તો અગત્યની બાબતો ચૂકી જશો. ઈશ્વરની સહાયથી તમે તમારા દિવસોનું આયોજન કરી શકો છો. ઈશ્વરનું સાંભળવા માટે સમય કાઢી શકો છો અને પછી તમે જે કરો તેમાં તેમનું સન્માન કરી શકો છો.
- (૧૧) એકલતા : સોશયલ મીડીયા અને આપણી ઝડપી ગતિશીલ જીવનશૈલી હોવા છતાં આજે મોટાભાગના યુવાનો એકલતા અનુભવે છે. હકીકતમાં દરેક વ્યક્તિના હૃદયમાં રહેલી “ઈશ્વર માટેની એક જગ્યા” ને ભરવા આ જગતની કોઈ બાબત પૂરી શકતુ નથી. આજે ઈસુને તમારું કેન્દ્ર બનવા દો. કેમકે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ. (હિબ્રુ ૧૩:૫)
- (૧૨) અદેખાઈ : જ્યારે આપણે ઈશ્વરના પ્રેમને આપણા હૃદયમાં ભરવા દઈએ છીએ, ત્યારે આપણે સૌથી કિંમતી ભેટ પસંદ કરીએ છીએ. આપણા સંજોગોમાં પણ તે આપણને સંતોષથી આશીર્વાદ આપશે. ફરીયાદી ન બનો, ન તો અદેખાઈ રાખો. તે ફક્ત તમને અને તમારા પરિવારને બરબાદ કરશે. “હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાંનો સડો છે.” (નીતિવચનો ૧૪:૩૦)
- (૧૩) અપરાધ : “માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.” (યોહાન ૮:૩૬) આપણ સર્વ ઈશ્વર સમક્ષ દોષિત છીએ અને ઘણીવાર અન્ય લોકો માટે દોષિત બનીએ છીએ. ખ્રિસ્તના વધસ્તંભ પરના કાર્યમાં વિશ્વાસથી મળેલી માફી માટે ઈશ્વરની સ્તુતિ થાઓ. તમારા દેવાદારોને માફ કરવા માટે ઈશ્વરની સહાય માગો અને જો તમે દોષિત ઠર્યા હો તો જલ્દીથી સમાધાન કરો.
- (૧૪) બીક : “યહોવા મારા પક્ષનો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરી શકશે ?” (ગી.શા. ૧૧૮:૬) તમારી સમસ્યા ભલે ગમે તે હોય, યુદ્ધ કે સતાવણી હોય, તમારી નોકરી ગઈ હોય કે ગરીબી અને ભૂખ હોય, બીમારી હોય કે મરણ હોય, જો તમે ઈસુમાં વિશ્વાસ રાખ્યો હશે તો તે તમને સંભાળશે. “જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.” (નીતિવચનો ૨૮:૨૫)
- (૧૫) નિષ્ફળતા : “જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.” (ગી.શા. ૧૦૩:૧૩-૧૪) ઈશ્વરને તમારું ધ્યાન રાખવા દો. તમારી નિષ્ફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરો. વિશ્વાસ કરો કે તે તમને પ્રેમ કરે છે. તેમની કૃપા પૂરતી છે.
- (૧૬) શંકા : “જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે.” (યોહાન ૨૦:૨૯) જ્યારે આપણે હૃદયભંગીત થઈએ છીએ અને આત્મામાં રાંક બનીએ છીએ ત્યારે દયાળુ ઈશ્વર આપણી પાસે આવે છે, તેમની સ્તુતિ કરો. તે તમારી શંકાઓના જવાબ આપવા માંગે છે. “યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.” (નીતિવચનો ૧૮:૧૦)
- (૧૭) નિરાશા : “મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છોડેથી હું તને અરજ કરીશ; જે ખડક પર હું મારી મેળે ચઢી શકતો નથી તે પર તું મને લઈ જજે.” (ગી.શા. ૬૧:૨) જ્યારે તમે શ્રેષ્ઠ બાબતો કરી હોય છતાં તે પૂરતી ન હોય તો છોડી દેશો નહિ. તેના બદલે ઈશ્વરને તેમના દૃષ્ટિકોણ માટે જણાવો. જો તમે તેમને પ્રથમ પ્રેમ કરો છો તો તે દરેક બાબત તમારા માટે સારી કરશે.
- (૧૮) ગુસ્સો : “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) ન્યાયી ક્રોધ પણ હોય છે. ઈશ્વર પોતે દરરોજ દુષ્ટો પર ક્રોધિત થાય છે. (ગી.શા. ૭:૧૧) પણ તે પવિત્ર છે અને આપણે નથી. ગુસ્સાને વધવા ન દો. જો તમારો સ્વભાવ ગરમ હોય અને સરળતાથી ગુસ્સે થતા હો તો ઈશ્વરને કહો કે તે તમને હૃદયની સાચી નમ્રતા શીખવે.
- (૧૯) પ્રેમ : જેઓએ ઈસુ વિશે સાંભળ્યું નથી તેઓને ઈશ્વર ખૂબ જ પ્રેમ કરે છે. પ્રાર્થના કરો કે તમે ઈશ્વરના પ્રેમના વાહક બનવામાં સફળ થાઓ અને ઈસુ વિશે હજી સુધી સાંભળ્યું ન હોય તેવા લોકો સાથે સંપર્કમાં રહેવા તેમને સહાય કરો. (યાકુબ ૪:૫)
- (૨૦) બોજ : પૃથ્વી પરના ખ્રિસ્તના એલચી તરીકે જેઓને સુવાર્તા મળી નથી તેવા લોકોને જણાવવા માટે તમને આજ્ઞા આપવામાં આવી છે. ઈશ્વર તમને ખોવાયેલા જગત માટે બોજ આપે અને ક્યાં કેવી રીતે વધુ ફળવંત અને ઉપયોગી થવાય તે બતાવે એવી પ્રાર્થના કરો. (માથ્થી ૨૮:૧૮-૨૦)

- (૨૧) સંગત : જેમ ચૂલામાં લાકડાના ટુકડા આગને સળગતા રાખે છે, તેમ આપણે ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે એકબીજાને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તમને સાથી વિશ્વાસીનો આધાર મળે તે માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે ઈશ્વર તમારો ઉપયોગ અન્ય ખ્રિસ્તીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે કરો. (હિબ્રુ ૧૩:૧)
- (૨૨) તકો : કેટલાક લોકો સવારે પ્રાર્થના કરે છે કે આખા દિવસના અંત પહેલા કોઈને ઈશ્વર તરફ દોરવા માટે તક પૂરી પાડે. ઈશ્વરે આવા મહેનતુ સુવાર્તિકો ઊભા કર્યા છે તે માટે ઈશ્વરનો આભાર માનો. (કલોસી ૪:૨-૩)
- (૨૩) પુનઃસ્થાપના : “તે મારા આત્માને તાજો કરે છે ...” (ગી.શા. ૨૩:૩૨) જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં રહેવા સમય કાઢીએ છીએ અને તેમના માટે આપણું હૃદય અને જીવન ખોલીએ છીએ ત્યારે આપણે રાહત અનુભવીએ છીએ. સર્વશક્તિમાન ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેની નજીક રહીએ, કારણ કે ઈશ્વર આપણને આશીર્વાદ આપવામાં આનંદિત થાય છે. આજે પુનઃસ્થાપિત થવા માટે તૈયાર રહો.
- (૨૪) માર્ગદર્શન : “પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.” (ગી.શા. ૨૩:૩૫) જ્યારે ભૂતકાળમાં દૃષ્ટિપાત કરીએ છીએ કે કેવી રીતે જરૂરીયાતના સમયે ઈશ્વરે દોરવણી આપી અને આપણા આત્માને કેવી રીતે તાજગી આપી તે બાબત આશ્ચર્ય પમાડે છે. આજે ફરીથી તેમના પર વિશ્વાસ કરવા તૈયાર બનો !
- (૨૫) નિર્ભયતા : “જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલુ તો યે હું કંઈપણ ભૂંડાઈથી બીશ નહિ. કેમકે તું મારી સાથે છે.” (ગી.શા. ૨૩:૪૨) મારા જીવનમાં તકલીફ, માંદગી, પીડા, વેદના અને મૃત્યુનો ભય હોય તો પણ ઈસુ મારી સાથે છે. તેથી તેમાંથી મને પસાર કરશે.
- (૨૬) દિલાસો : “તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે.” (ગી.શા. ૨૩:૪૫) ઈસુ ખ્રિસ્તમાં સલામત રહેવાનો કેવો અકથ્ય આનંદ છે. આપણે જીવનને નિર્જન અને નિરાશાજનક બનાવનાર ક્ષણો અને સંજોગોને જાણીએ છીએ, પરંતુ જેમ જેમ આપણે ઈસુને આપણામાં આવવા દઈએ છીએ તેમ તેમ આપણા આત્માને ઉત્તેજન તથા આપણને નવી શક્તિ અને આત્મવિશ્વાસ મળે છે.
- (૨૭) ભલાઈ : “નિશ્ચે મારી જીંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે.” (ગી.શા. ૨૩:૬) ઈશ્વરની મારા પ્રત્યેની ભલાઈને કારણે તે મને મારા કુટુંબ અને હું જેના સંપર્કમાં રહું છું તે લોકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવે છે. આ રીતે ઈશ્વરની હાજરી અને કૃપા તમારા જીવનમાં પણ પ્રગટ થવા માંગે છે.
- (૨૮) ચમકનાર પ્રકાશ : અંધકારનો રાજકુમાર તેનો સમય ઓછો છે તે જાણે છે. તેની વ્યુહરચના જગતને અનૈતિકતા, બળવો, આત્મિક અધર્મ અને અરાજકતામાં દોરી જવાની છે. તેથી સમય કાઢો. “તેમ જ તમે તમારું અજવાળુ લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માથ્થી ૫:૧૬)
- (૨૯) પીછેહઠ ન કરશો : “પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હઠે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.” (હિબ્રુ ૧૦:૩૮) જ્યારે અધર્મ વધશે ત્યારે ખ્રિસ્તીઓ અને તેમના સંદેશનો વિરોધ કરવામાં આવશે. હિંમતવાન બનો ! તમારી જગ્યાએ ઊભા રહો ! “અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.” (માથ્થી ૧૦:૨૮)
- (૩૦) પ્રાર્થના : “નિત્ય પ્રાર્થના કરો.” (૧ થેસ્સા. ૫:૭) રોજીંદા જીવનના નિયમો, કુટુંબ, સંજોગો, કામ માણસને પ્રાર્થનાની ઉપેક્ષા તરફ દોરી શકે છે. પ્રાર્થના મન અને હૃદયને સજાગ રાખે છે અને જે લડાઈનો સામનો તે કરે છે તેનો સામનો કરવા માટે સંવેદનશીલ બનાવે છે. હે ઈશ્વર અમારું પ્રાર્થનામય જીવન નિયમિત બને તે માટે સહાય કરો.
- (૩૧) વિશ્વાસુપણું : પરીક્ષણ દરેક જગ્યાએ હોય છે અને જે માણસના જાતીય અને નૈતિક જીવનને સામેલ કરે છે તે ઉજાગર થઈ જાય છે. ફિલીપી ૪:૭ જણાવે છે કે “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખો.” હે ઈશ્વર, મારા મન અને હૃદયને દોરો કે જેથી હું હંમેશા મારી પત્ની પ્રત્યે વિશ્વાસુ રહું.

ટ્રાન્સ વર્લ્ડ રેડિયો - ઈન્ડિયા

પો.બો. નં. ૨૦૩૬, ફતેહગંજ, વડોદરા - ૩૯૦૦૦૨

M. No. : 9327621391

Free MP3 download : radio882.com, twr media app

FB : <https://www.facebook.com/twrgujarati/>

Youtube : youtube.com/c/twrindiagujarati

Gujarati Internet FM Radio TWR : <http://Radio882.com/fmgujarati>

Gujarati TV Program : Gujarat First Channel, Time : 06:30 to 07:00 (Morning) (Monday to Saturday)